



# PATIDAR BUILDCON LTD.

Regd. Off.: Lati Bazar, Joravarnagar - 363 020  
Dist. Surendranagar (Gujarat)

E-mail : patidarbuildconltd@rocketmail.com  
CIN No.: L99999GJ1989PTC058691

Ref. No.:

Date :

**Date: 30/01/2020**

To,  
Gen. Manager (DCS)  
BSE limited.  
P J Towers, Dalal Street,  
Fort, Mumbai-400001

**SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.**

**REF: COMPANY CODE BSE: 524031 (PATIDAR BUILDCON LIMITED)**

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in one English Newspaper and one Regional Language newspaper for Intimation of Board Meeting to be held on Wednesday, 12<sup>th</sup> February, 2020 at the registered office of the Company in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

**FOR, PATIDAR BUILDCON LIMITED**

*Rajnikant@patel*

**MR. RAJNIKANT PATEL**  
**MANAGING DIRECTOR**  
**(DIN:01218436)**



## Short Takes

**Gadkari Urges Cos to Cash in on New Expressway Projects**

**NEW DELHI:** Union minister Nitin Gadkari on Wednesday urged industry players to cash in on the huge potential that 22 upcoming express highways hold in the areas of alternative fuel, electric highway and charging stations. The Road Transport, Highways and MSME Minister said that projects specially about ₹1 lakh crore Delhi-Mumbai express highway can offer instant right of way to players interested in setting up LNG stations, electric charging stations or petrol pumps. Addressing a conference on 'Future Fuels for Transportation' by FICCI, the minister said plans were afoot to set up 2,000 petrol pumps, including LNG. —PTI

**Oil Min Pitches for Inclusion of Natural Gas in GST**

**NEW DELHI:** Ahead of the budget, the oil ministry has made a renewed pitch for inclusion of natural gas in the ambit of GST to promote the use of the environment-friendly fuel by reducing multiplicity of taxes and improving business climate. "Currently natural gas is taxed under the VAT regime with VAT ranging from 3% to 20% across states," the ministry said. If brought under GST, natural gas will attract a uniform rate of tax at the consumption point anywhere in the country after doing away with current rates of excise duty and VAT. This, it said, would "result in an increase in state domestic product and socio-economic development owing to increased economic activities". —PTI

**New Bill to Prevent Illegal Fishing in EEZs**

**NEW DELHI:** In order to prevent illegal fishing current fiscal to 447.21 million tonnes (MT), a shipping ministry report has said. These non-major ports had recorded a cargo traffic of 426.53 MT in the April-December period of 2018-19. —PTI

**KONARK BUILDERS & DEVELOPERS LIMITED**

505, Abhishek Adroit, Nyay Marg, Nr. Mansi Circle, Vastrapur, Ahmedabad. www.konarkdevelopers.in

**NOTICE OF BOARD MEETING**

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 that the meeting of the Board of Directors of the company is scheduled to be held on Wednesday, 12th February, 2020 to consider and approve the unaudited Financial Results for the quarter and nine month ended on 31st December, 2019. For, Konark Builders & Developers Limited

Place : Ahmedabad  
Date : 29-1-2020

CIN : L51109GJ1984PLC094498

Sd/- Dipen Kumar Limbani (Managing Director)  
Din : 08271635



सेन्ट्रल बैंक ऑफ इंडिया  
सेन्ट्रल बैंक ऑफ इंडिया  
CENTRAL BANK OF INDIA

क्षेत्रीय कार्यालय, लाल दरवाजा, अहमदाबाद

Whereas The undersigned heir  
of India, Kuber Nagar Branch, Al-

Reconstruction of Financial Assets and  
and in exercise of powers conferred upon  
Security Interest (Enforcement) Rule  
30.10.2019 calling upon the borrower to  
the amount mentioned in the notice being

Thousand Two Hundred Seventy Two  
within 60 days from the date of receipt of

The Borrower having failed to  
the Borrower and the public in general  
Possession of the property described  
on him under Sub-Section (4) of Section  
interest Enforcement Rules 2002 on this

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and

to deal with the same.

Within 60 days from the date of receipt of

The Borrower in particular and</

